

અટલ પેન્શન યોજના

ભારત સરકારની બાંધધારીકૃત યોજના

(લઘુત્તમ રોકાણ, મહત્તમ લાભો, વૃદ્ધાવસ્થા દરમિયાન)

જો તમારી ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ ની વચ્ચે છે તો તમે અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકો છો. આજેજ તમારી નજીકની બેંક ની શાખા / પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરો.

* ૧ લી ઓક્ટોબર ૨૦૨૧ થી કોઈપણ નાગરિક કે જે આવકવેરા ચૂકવનાર છે અથવા છે (આવકવેરા અધિનિયમ ૧૯૬૧ હેઠળ) તે APY માં જોડાવા માટે પાત્ર રહેશે નહીં.

વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો:

- પીએફઆરડીએ વેબસાઇટ: <https://www.pfrda.org.in/> >> NPS >> અટલ પેન્શન યોજના >> APY યોજનાની વિગતો, <https://www.pfrda.org.in/> >> NPS >> અટલ પેન્શન યોજના >> FAQs.

અથવા

- પ્રોટીન-CRA વેબસાઇટ: www.npskra.nsdl.co.in >> ઘર >> અટલ પેન્શન યોજના >> પરિચય >> APY યોજનાની વિગતો, www.npskra.nsdl.co.in >> હોમ >> અટલ પેન્શન યોજના >> FAQ >> APY FAQ's..

- APY ચેટબોટ (KYNA) પ્રશ્નો ના રીઅલ ટાઇમ રિઝોલ્યુશન માટે પ્રોટીન CRA વેબસાઇટ પર ઉપલબ્ધ છે



અથવા

- NPS ટ્રસ્ટવેબસાઇટ <http://www.npstrust.org.in> >> અટલ પેન્શન યોજના >> APY Schemedetails.pdf, <http://www.npstrust.org.in> >> અટલ પેન્શન યોજના >> APYFAQs10092015.pdf

અથવા

- PFRDA ના અટલ પેન્શન યોજના હેલ્પ ડેસ્ક (ટોલ ફ્રી) ને 1800 1100 69 પર કોલ કરો.

અથવા



- APY પોડ કાસ્ટ સાંભળો

અથવા

- APY YouTube વીડીઓ જુઓ



APY ની મૂળભૂત સુવિધાઓ

- APY ભારત સરકાર દ્વારા બાંધધારી આપવામાં આવેલ લઘુત્તમ માસિક પેન્શન રૂ.1000, રૂ.2000, રૂ.3000, રૂ.4000, રૂ. 5000 ની પીસંદગી નો વિકલ્પ આપે છે. 60 વર્ષની ઉંમર પછી દર મહિને.
- APY ખાતું ખોલવા માટે, વ્યક્તિ 18 થી 40 વર્ષની વય વચ્ચે ભારતનો નાગરિક હોવો જોઈએ અને તે આવકવેરા ચૂકવનાર ન હોવો જોઈએ.
- APY ખાતું ખોલાવતી વખતે નોમિનેશન અને જીવનસાથી ની વિગતો આપવી ફરિજયાત છે.
- બચત બેંક ખાતા માં થી ઓટો ડેબીટ સુવિધા દ્વારા માસિક અથવા ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક ધોરણે યોગદાન આપી શકાય છે.

60 વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી APY ના ત્રણ ગણા લાભો



1. રૂ.1000 થી રૂ.5000 સુધીનું આંજીવન લઘુત્તમ બાંધધારીકૃત પેન્શન અરજદાર / સબ્સ્કાઇબર ને દર મહિને



2. અરજદાર / સબ્સ્કાઇબર ના મૃત્યુ પછી જીવનસાથી ને જીવનભર માટે સમાન પેન્શન.



3. અરજદાર / સબ્સ્કાઇબર ના જીવનસાથી ના મૃત્યુ પછી ઉપભોક્તાના નામાંકિત ને 60 વર્ષની ઉંમર સુધી સંચિત પેન્શન સંપત્તિ / કોર્પસ પરત

APY માં કેવી રીતે જોડાવું અથવા સબ્સ્કાઇબ કરવું

- એપ્લીકેશન ફોર્મ ભરો અને તેને તેમારી બેંક સબમિટ કરો.
- આધાર eKYC નો ઉપયોગ કરીને ઓનલાઇન ઓનબોરડીંગ પ્લેટફોર્મ <https://enps.nsdl.com/eNPS/APySubRegistration.html>



અથવા

- APY મોબાઇલ એપ્લીકેશન દ્વારા APY નોંધણી જે APY વપરાશકર્તાઓ માટે મફતમાં ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ યુઝર્સ સર્ચ ઓપ્શનમાં 'APY અને NPS Lite' ટાઇપ કરીને ગૂગલ પ્લે સ્ટોર પરથી APY મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.



અથવા

- તમારી બેંક ના તમારા નેટ બન્કીંગ ખાતા માં લોગીન કરો અને જોડાઓ. (જો તમારી બેંક દ્વારા પ્રદાન કરવામાં આવે તો)

અથવા

- બેંકના વેબ પોર્ટલ પર જાઓ અને સીધા APY માટે અરજી કરો. (જો તમારી બેંક દ્વારા પ્રદાન કરવામાં આવે તો)